

Seat No. : _____

AJ-118

April-2023

B.A., Sem.-IV

CC-211 : Economics
(Principles of Economics-02)

Time : 2:30 Hours]

[Max. Marks : 70

સૂચના : જમણી બાજુના અંક પ્રશ્નોના ગુણ દર્શાવે છે.

1. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચનો અર્થ આપી, બંને વચ્ચેનો સંબંધ સમજાવો. 14
અથવા
પૂર્ણ હરીફાઈ અને ઈજારામાં સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચેનો સંબંધ સમજાવો. 14
2. પૂર્ણ હરીફાઈનો અર્થ આપી, પેઢીની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. 14
અથવા
પૂર્ણ હરીફાઈમાં પેઢીની ટૂંકાગાળાની અને લાંબાગાળાની સમતુલા સમજાવો. 14
3. ઈજારાની વ્યાખ્યા અને લક્ષણોની ચર્ચા કરી, ઈજારામાં કિંમત નિર્ધારણની સમજૂતી આપો. 14
અથવા
ઈજારાયુક્ત હરીફાઈનો અર્થ આપી, પેઢીના લક્ષણોની ચર્ચા કરો. 14
4. વહેંચણીના સીમાંત ઉત્પાદકતાના સિદ્ધાંતની મર્યાદાઓ સાથે સવિસ્તર ચર્ચા કરો. 14
અથવા
પ્રો. રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત સમજાવો. 14
5. બહુવિકલ્પ પ્રશ્નો : (કોઈપણ સાત) 14
(1) અસ્થિર ખર્ચની રેખા કેવી હોય છે ?
(A) X ધરીને સમાંતર (B) Y ધરીને સમાંતર
(C) ઋણ ઢાળની (D) ધન ઢાળની
(2) ટૂંકાગાળામાં કયું ખર્ચ ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધિત નથી ?
(A) સ્થિર ખર્ચ (B) અસ્થિર ખર્ચ
(C) કુલ ખર્ચ (D) સીમાંત ખર્ચ

- (3) કુલ ખર્ચ / ઉત્પાદનના એકમો = _____
- (A) કુલ ખર્ચ (B) સીમાંત ખર્ચ
(C) સ્થિર ખર્ચ (D) સરેરાશ ખર્ચ
- (4) કયા બજારમાં સીમાંત આવક અને સરેરાશ આવક બંને જુદી-જુદી હોય છે ?
- (A) ઈજારો (B) શુદ્ધ હરીફાઈ
(C) પૂર્ણ હરીફાઈ (D) એકપણ નહીં
- (5) પૂર્ણ હરીફાઈમાં પેઢીની વસ્તુની માંગ કેવી હોય છે ?
- (A) સંપૂર્ણ મૂલ્યસાપેક્ષ (B) સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ
(C) વધુ સાપેક્ષ (D) ઓછી સાપેક્ષ
- (6) નીચેનામાંથી ટૂંકાગાળાની અસામાન્ય નફાની શરત કઈ છે ?
- (A) સ.આ. = સી.આ. (B) સ.આ. < સ. ખ.
(C) સ.આ. > સ. ખ. (D) સ.આ. = સ. ખ. = સી.આ. = સી.ખ.
- (7) પૂર્ણ હરીફાઈમાં પેઢીને લાંબાગાળે _____ મળે છે.
- (A) અસામાન્ય નફો (B) ખોટ
(C) સામાન્ય નફો (D) એકપણ નહીં
- (8) નીચેનામાંથી કયું મુખ્ય લક્ષણ ઈજારાયુક્ત હરીફાઈમાં જ જોવા મળે છે ?
- (A) સમાનગુણી વસ્તુ (B) સમાન કિંમત
(C) વસ્તુ વિકલન (D) અસંખ્ય ગ્રાહકો
- (9) શુદ્ધ ઈજારામાં કેટલા વિકેતાઓ હોય છે ?
- (A) મર્યાદિત (B) એક જ
(C) અમર્યાદિત (D) થોડાક જ
- (10) કઈ પરિસ્થિતિમાં સાધનને શૂન્ય ભાડું મળે છે ?
- (A) સાધન પુરવઠો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ (B) સાધન પુરવઠો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ
(C) સાધન પુરવઠો મૂલ્ય સાપેક્ષ (D) સાધન પુરવઠો મૂલ્ય અનપેક્ષ
- (11) તફાવતી ભાડાનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો ?
- (A) મેયર (B) માર્શલ
(C) રિકાર્ડો (D) રોબિન્સન
- (12) સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત શેની સાથે સંબંધિત છે ?
- (A) રાષ્ટ્રીય આવક નિર્ધારણ
(B) રાષ્ટ્રીય આવકની વ્યક્તિગત વહેંચણી
(C) રાષ્ટ્રીય આવકની સાધનગત વહેંચણી
(D) અંદાજીત રાષ્ટ્રીય આવક

Seat No. : _____

AJ-118

April-2023

B.A., Sem.-IV

**CC-211 : Economics
(Principles of Economics-02)**

Time : 2:30 Hours]

[Max. Marks : 70

Instruction : Figures to right indicate marks.

1. Give the meaning of average cost and Marginal cost and explain its relationship. **14**

OR

Explain the relation between Average Revenue and Marginal Revenue under Monopoly and Perfect Competition Market. **14**

2. Discuss the meaning and characteristics of Perfect Competition. **14**

OR

Explain the Short-term and Long-term equilibrium in Perfect Competition Market. **14**

3. Discuss the definition and characteristics of Monopoly price determination of Monopoly Market. **14**

OR

Discuss the meaning and characteristics of Monopolistic Competition. **14**

4. Discuss Marginal Productivity Theory of Distribution with limitation. **14**

OR

Explain the Ricardian Theory of Rent. **14**

5. Multiple Choice Questions : (Any **Seven**) **14**

(1) How is Variable Cost Curve ?

(A) Parallel to X axis

(B) Parallel to Y axis

(C) Negative Slop

(D) Positive Slop

(2) Which Cost is not connected with output in the Short-run ?

(A) Fixed Cost

(B) Variable Cost

(C) Total Cost

(D) Marginal Cost

- (3) Total Cost / Total Output = _____.
 (A) Total Cost (B) Marginal Cost
 (C) Fixed Cost (D) Average Cost
- (4) In which of the following Market, A. R. and M.R. both are different ?
 (A) Monopoly (B) Pure Competition
 (C) Perfect Competition (D) None of these
- (5) Under Perfect Competition, demand for a firm's product is _____.
 (A) Perfectly Elastic (B) Perfectly Inelastic
 (C) More Elastic (D) Less Elastic
- (6) Which of the following condition represents short-term for supernormal profit ?
 (A) A.R. = M.R. (B) A.R. < A.C.
 (C) A.R. > A.C. (D) A.R. = A.C. = M.R. = M.C.
- (7) In the Long-run, a firm under Perfect Competition gets _____.
 (A) Abnormal Profit (B) Loss
 (C) Normal Profit (D) None of these
- (8) Which of the following is the main characteristic of Monopolistic Competition ?
 (A) Homogeneous Product (B) Equal Price
 (C) Product Differentiation (D) Large Numbers of Buyers
- (9) How many numbers of sellers are there in Pure Monopoly ?
 (A) Limited (B) Only one
 (C) Unlimited (D) Few
- (10) In which situation all the earning of Factor become Zero ?
 (A) Factor of supply is Perfectly Elastic.
 (B) Factor of supply is Perfectly Inelastic.
 (C) Factor of supply is Elastic.
 (D) Factor of supply is Inelastic.
- (11) Who propounded the theory of differential rent ?
 (A) Meyers (B) Marshall
 (C) Ricardo (D) Robinson
- (12) Marginal Productivity Theory is concerned with _____.
 (A) Determination of National Income
 (B) Personal Distribution of National Income
 (C) Functional Distribution of National Income
 (D) Estimation of National Income
-